

કતારગામ પોલીસ સ્ટેશન સુરત શહેર

કતારગામ પો.સ્ટે. । ગુ.ર.નં.૨૦૩/૨૦૧૮ ઈ.પી.કો. કલમ-૩૦૨, ૩૯૪, ૪૫૨ મુજબના કામે મરણ જનાર રીનાબેન નાની ને તા.૦૯/૦૮/૨૦૧૮ ના કલાક ૧૪/૦૦ થી કલાક ૧૮/૩૦ દરમ્યાન કોઇ અજાણ્યા ઇસમે તેણીના ફ્લેટમાં પ્રવેશ કરી કોઇ અગમ્ય કારણસર બેડરૂમમાં તેનું ગળુ દબાવી અથવા કોઇ સાધન વડે ગળે ટુંપો આપી મોત નીપજાવી બેડ રૂમના કબાટના ચોર ખાનામા રાખેલ સોનાની બે ચેઇન અંદાજે વીસ ગ્રામની જેની કિ.રૂ. ૪૦,૦૦૦/- તથા સોનાની ત્રણ વીંટી અંદાજે પંદર ગ્રામ જેની કિ.રૂ.૩૦,૦૦૦/- તથા કાનની સોનાની જોડ નંગ ૧ જે છ ગ્રામની જેની કિ.રૂ.૧૦,૦૦૦/- તથા રોકડા રૂપિયા ૧૫,૦૦૦/ મળી કુલ્લે ૯૫,૦૦૦/-ના મતાની લુંટ કરી નાસી ગયેલ જેની ફરીયાદ મરણ જનારના પતિનાઓએ ઉપરોક્ત નંબર અને કલમથી ગુનો રજીસ્ટ્રેશન કરાવેલ

સદર ગુનાની તપાસ કરતા શકમંદ લાગતા ફરીયાદીની ઉલટ તપાસ કરતા જણાય આવેલ કે આ કામે મરણ જનાર રીનાબેન મોર્ડન ટાયપની હોય તથા તેના પતિ એટલે કે આ કામના ફરીયાદી નોર્મલ પર્યાન હોવાથી આરોપી તથા મરનાર રીનાબેનનાઓનો ઘરકામ બાબતે અવર નવર ઝઘડો તકરાર થતો હોય અને ફરીયાદીની માં સાથે પણ મરનારનો ઘરકામ બાબતે બોલાચાલી થતી હોય આજ કારણોસર અગાઉ ફરીયાદી તથા મરનાર છુટા છેડા લેવા સુધીની વાત પર આવી ગયેલ અને રોજના ઝઘડાના ત્રાસના કારણે બનાવના સાત આઠ દિવસ પહેલા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કીશોરને આ કામના આરોપી મનોજે તેની પત્ની રીનાને મારી નાંખવાની વાત કરેલ અને આરોપીએ તેની પત્ની રીના સાથે ઘરકામ બાબતે ઝગડાથી ત્રાસી જઈ ગઈ તારીખ ૯/૮/૨૦૧૮ ના રોજ બપોરના દોઢેક વાગ્યે જમી કાયદાના સંઘર્ષમા આવેલ બાળ કીશોરનાએ મરનારના બેડરૂમમા ઓશીકુ લેવા જવાનો ઢોંગ કરી ઓશીકાથી મરનારનું મોઢુ દબાવી આરોપી મનોજે દોરી વડે મરનારના ગળે ટુંપો આપી મોત નીપજાવેલ છે આ કામે મરણ જનારના પતિ (૧) મનોજભાઈ દેવશીભાઈ ચોટલીયા જાતે (કડિયા કુંભાર) ઉ.વ.૩૦ ધંધો. કડિયાકામ રહે. ફ્લેટ નં.૩૦૩, બાલાજી એપાર્ટમેન્ટ રણછોડનગર સોસાયટી ધનમોરા સર્કલ પાસે કતારગામ, સુરતનાઓને અટક કરવામાં આવેલ છે તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ડીટેઇન કરી ગુન્હાનો ભેદ ઉકેલવામાં આવેલ છે.